



ધી સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી

(આઇ. એસ. ઓ. ૯૦૦૧:૨૦૧૫ પ્રમાણિત સંસ્થા),

"સમૃદ્ધિ", ૪થો માળ, મક્કાઈ પુલ, નાનપુરા, સુરત - ૩૯૫ ૦૦૧

ફોન નં. ૨૨૯૧૧૧૧

E-mail : info@sgcci.in

ફેક્સ નં. ૦૨૬૧-૨૪૭૨૩૪૦

Website : www.sgcci.in

રેફ નં.

તા: ૧૯/૩/૨૦૧૯


તંત્રીશ્રી, _____ સુરત.

મે. સાહેબશ્રી,

જત નીચેની પ્રેસ નોટ આપના દૈનિકમાં પ્રસિદ્ધ કરી આભારી કરશોજ.

લિ.

આપનો વિશ્વાસુ,


(ખાતાકીય વડા)

સુમેળ અને સામૂહિક પ્રયાસ વગર ઉદ્યોગનું સાહસ શક્ય નથી

ચેમ્બર દ્વારા 'ઉદ્યોગ સાહસિકોના ભુત, વર્તમાન અને ભવિષ્ય' વિષય ઉપર સેશન યોજાયુ

સુરત. ધી સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતિ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીના સહકારથી ગતરોજ કાપોદ્રા સ્થિત શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતિ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ખાતે 'ઉદ્યોગ સાહસિકોના ભુત, વર્તમાન અને ભવિષ્ય' વિષય ઉપર સેશનનું આયોજન કર્યુ હતુ. જેમાં હાઇડ્રો ન્યુમેટીક ટેકનીક્સના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પંકજ ત્રિવેદીએ વિદ્યાર્થીઓ અને યુવાઓને માર્ગદર્શન આપ્યુ હતુ.

શ્રી પંકજ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે આંત્રપ્રિન્યોર માટે બ્રોડ માઇન્ડ હોવુ જોઇએ અને કલેક્ટીવ ડિસીઝન લેવાની આવડત હોવી જોઇએ. ઉદ્યોગ સાહસિકને રોજ નવુ નવુ શીખતા રહેવુ પડે અને અભ્યાસ કરવો પડે છે. ઉદ્યોગમાં તમે કમાવો કે ગુમાવો એના માટે એકમાત્ર તમારી જ જવાબદારી બને છે. તેમણે કહ્યુ કે, ભારત એ પહેલા દુનિયાનો સર્વશ્રેષ્ઠ આંત્રપ્રિન્યોર દેશ તરીકે ઓળખાતો હતો. ભારતની શિક્ષણ પ્રથામાં જ ઉદ્યોગ સાહસિકતા જોવા મળતી હતી. એક ગામમાં રહેતા ચારથી પાંચ હજાર લોકોમાંથી શિક્ષક, તલાટી કમ મંત્રી, ડોક્ટર અને પોસ્ટ માસ્ટર જેવા ચારથી પાંચ નોકરીયાત હતા. બાકીના પોતપોતાનો ધંધો જ કરતા હતા. અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ બાદ ભારતીય શિક્ષણ પ્રથા સદંતર બદલાઈ ગઈ. વારસાગત આંત્રપ્રિન્યોરશિપ અને ધંધાકીય સુઝ મેળવવાની જે ખરી પદ્ધતી હતી તે તુટી ગઈ.

ઉદ્યોગ સાહસિકોના વર્તમાન વિશે પ્રકાશ પાડતા તેમણે કહ્યુ હતુ કે, આજનો યુવા વર્ગ હાઇલી કન્ફ્યુઝ છે. નોકરી કરવી કે ધંધો બંને બાજુએ અટવાય છે. પણ જો એમાં કલેક્ટીવ એફર્ટ હોય તો દરેકના સાઇઝ પ્રમાણે બિઝનેસ મળી રહે. મિકેનીકલ, સિવિલ અને ઇલેક્ટ્રીકલ એન્જીનિયર તથા એકાઉન્ટ્સ અને આર્ટના યુવકો મળીને નાની કંપની શરૂ કરી બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનું કામ કરી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉદ્યોગ સાહસિક બનવાનું વિચારી લેનાર યુવાઓ બહારના દેશોમાંથી ઇમ્પોર્ટ નહીં કરવી પડે એવી વસ્તુઓને ટાર્ગેટ કરીને બિઝનેસ શરૂ કરી શકે છે. એના માટે તેઓને બિઝનેસ અને સર્વિસ સ્ટાન્ડર્ડ સમજવા પડશે. કેમિકલ, ફર્ટીલાઇઝર અને મશીનરી જેવા વિવિધ સેક્ટરોમાં મોટી કંપની જે કંઈ વસ્તુઓ બનાવતી હશે તેની પાછળ અન્ય કંપનીઓ નાની – નાની વસ્તુઓ બનાવતી હોય છે. કોલેજમાં ફર્સ્ટ અને સેકન્ડ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મેન્યુફેક્ચર, સર્વિસ, અને સેફ્ટીના સ્ટાન્ડર્ડ સમજવા પડશે. હાર્મોનાઇઝ અને કલેક્ટીવ એફર્ટ વગર આંત્રપ્રિન્યોર બનવું શક્ય નથી.

શ્રી ત્રિવેદીએ વધુમાં કહ્યું હતું કે, મેન્યુફેક્ચરીંગ કરવાનું વિચારનાર ઉદ્યોગ સાહસિકોએ એવી વસ્તુઓ શોધવી પડશે કે જે આપણે આયાત કરવી પડે છે અને એ આપણા દેશમાં બનાવી શકીશું. એમાં મેક ઇન ઇન્ડિયા અને સ્કીલ ડેવલપમેન્ટની યોજનાઓનો લાભ લઈ શકાય છે. કેટલાક આંત્રપ્રિન્યોર્સ યોગ્ય માર્ગદર્શનને અભાવે સફળ થતા નથી. એવા ઉદ્યોગ સાહસિકોએ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ઇન્ક્યુબેશનનો સપોર્ટ લેવો જોઈએ. આપણે જે વસ્તુઓ બનાવીએ છીએ એની ક્વોલિટી તપાસવા માટે સરકારે એજન્સીઓ બનાવી છે. વૈશ્વિક બજારમાં ટકી રહેવા માટે પ્રોડક્ટમાં સુધારો લાવી શકાય છે. કારણ કે વિદેશની માર્કેટોમાં ટકી રહેવા માટે આંતર રાષ્ટ્રીય લેવલના સ્ટાન્ડર્ડ મેઇન્ટેન કરવા પડશે.

ચેમ્બરના એક્ઝીક્યુટીવ સેલના કન્વીનર શ્રી પ્રદીપ પટેલ અને આઇપીઆર કમિટીના ચેરમેન શ્રી પરેશ લાઠીયાએ સેશનમાં પ્રાસંગિક વિધી કરી હતી. વક્તાશ્રીએ વિદ્યાર્થીઓના જુદા-જુદા સવાલોના સંતોષકારક જવાબ આપ્યા હતા. એસટીબીએસ ટ્રસ્ટના પ્લેસમેન્ટ એન્ડ ઇન્ડસ્ટ્રી રિલેશન એડવાઇઝર ડૉ. દેવેન્દ્ર સુલેરેએ વક્તાશ્રી તેમજ સેશનમાં ઉપસ્થિત તમામનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સેશનનું સમાપન થયું હતું.